

ત્વરિત જાહેરાત માટે

બ્રેમ્પટનમાં નેશનલ ઇન્ડિજિનસ પિપલ્સ ડે (રાષ્ટ્રીય આદિજાતિ લોક દિન) નો સ્વીકાર

બ્રેમ્પટન, ઓન્ટારિયો (09 જૂન 2022) – નેશનલ ઇન્ડિજિનસ પિપલ્સ ડે (રાષ્ટ્રીય આદિજાતિ લોક દિન)ની સ્વીકૃતિ માટે સિટી ઓફ બ્રેમ્પટન તમને કેન વિલવાન્સ સ્કવેર ખાતે બપોરે 12 થી સાંજે 8 સુધી જુન 22ના રોજ પધારવાનું આમંત્રણ પાઠવે છે. આદિજાતિના લોકોની માલિકીના વિક્રેતાઓનું બજાર, સૂર્યાસ્ત ઉત્સવ, બોર્ન ઇન દ નોર્થ લિમિટેડ દ્વારા થનાર બિગ ડ્રમ આર્ટ ઇન્સ્ટોલેશન, ફાયરસાઈડ ચેટ અને લાઈવ કાર્યક્રમો કરીને બ્રેમ્પટનના વૈવિધ્યપૂર્ણ પચરંગીપણા, સંસ્કૃતિ અને ઇતિહાસને ઉજવીશું.

જુન 21ના રોજ, કેનેડા નેશનલ ઇન્ડિજિનસ પિપલ્સ ડે (રાષ્ટ્રીય આદિજાતિ લોક દિન) મનાવીને અને ઇતિહાસ, ધરોહર અને ફર્સ્ટ નેશન્સ, ઇન્ટુઈટ અને મેટિસ લોકોના વૈવિધ્યનો સ્વીકાર કરશે.

આદિજાતિના લોકોની માલિકીના વિક્રેતા બજાર

બપોરે 12 થી સાંજે 8 સુધી જુન 22ના રોજ આ રૂબરૂ થઈ શકાય એવા માર્કેટમાં સપોર્ટ લોકલ, અને આદિજાતિના કારીગરોને સમર્થન આપશો જ્યાં હશે બીડેડ અને ક્રિસ્ટલ જ્વેલરી, કવિતા, કપડાં, એસેસરિઝ, આર્ટવર્ક અને બીજું ઘણું બધું. વિક્રેતાઓની પૂર્ણ સૂચિ જોવા માટે brampton.ca/NIPD.

સૂર્યાસ્ત ઉત્સવ

સાંજે 6 થી 8 વચ્ચે ફાયરસાઈડ ચેટમાં ભાગ લો, ચિપ્પેવા ટ્રેવેલર્સ (Chippewa Travellers) અને ડિએન તથા જોહન હુપફિલ્ડ (Deanne & John Hupfield) દ્વારા લાઈવ કાર્યક્રમ થશે અને બોર્ન ઇન દ નોર્થ લિમિટેડ દ્વારા બિગ ડ્રમ તરીકે ઓળખાતા આર્ટ ઇન્સ્ટોલેશનનું અનાવરણ જોઈ શકાશે.

બિગ ડ્રમ આર્ટ ઇન્સ્ટોલેશન

[બોર્ન ઇન દ નોર્થ લિમિટેડ](#) દ્વારા નિર્મિત 10 ફૂટ ઊંચું બિગ ડ્રમ ઇન્સ્ટોલેશન રાષ્ટ્ર અને વસુધાના ધબકારનું સ્વરૂપ છે, ઉત્સવની ઉજવણી કરવા ભેગા થવાનું પ્રતિક. આખા ટર્ટલ ટાપૂ પર ઉત્સવ મનાવવા માટે ડ્રમનો ઉપયોગ એકબીજા સાથે કરવાનો ત્યાંની અનેક આદિજાતિ સંસ્કૃતિઓનો રિવાજ છે. બિગ ડ્રમ ઇન્સ્ટોલેશનનું વિઝન આ ડ્રમ બનાવીને દર્શાવીને લોકજાતિઓનું ગૌરવ અને સ્વીકૃતિના એક જીવંત પ્રતિક તરીકે દર્શાવવાનું છે. કોઈપણ સાંસ્કૃતિક મેળાવડામાં ડ્રમનો ધ્વનિ મોટા ભાગે સૌથી પહેલા સંભળાતો આવ્યો છે અને આ કૃતિમાં બોર્ન ઇન દ નોર્થ લિમિટેડ દ્વારા આ લાગણીને કેદ કરવાનો આશય હતો.

બોર્ન ઇન દ નોર્થ લિમિટેડ એક સર્જનાત્મક સ્ટુડિયો છે જેની માલિકી જોડિયા બંધુ ક્રિસ અને ગ્રેગ મિચેલની છે તેમની કલા તેમની પોતાની શૈલીના દર્શન કરાવે છે અને તે માનવ અને કુદરત વચ્ચેના સંબંધ પર કેન્દ્રિત રહી છે. તેમની જીવનગાથા અને જાત અનુભવોને ધ્યાન પર લઈએ તો તેમની મિકમાક્ની ધરોહર (Mi'kmaq heritage), સંગીત સાધના અને કેનેડામાં થયેલ ઉછેરમાંથી મળેલ પ્રેરણા છતી થાય છે.

સિટી ઓફ બ્રમ્પટનના નેશનલ ઇન્ડિજિનસ પિપલ્સ ડે (રાષ્ટ્રીય આદિજાતિ લોક દિન)ના ઉત્સવ વિશે વધુ જાણકારી મેળવવા માટે મુલાકાત લો brampton.ca/NIPD.

સુવાક્યો

કેન વ્હિલાન્સ સ્કવેરમાં થનાર રાષ્ટ્રીય આદિજાતિ લોક દિને જુન 22ના રોજ અમારી સાથે જોડાવ અને જાણી લો કે ફર્સ્ટ નેશન્સ, ઇનુઇટ અને મેટિસ સમાજના અનુભવો, તેમની વર્ષવિધ્યપૂર્ણ સંસ્કૃતિઓ કેટલી સમૃદ્ધ છે.

- પૅટ્રિક બ્રાઉન, મેયર, સીટી ઓફ બ્રમ્પટન

"બ્રમ્પટન પચરંગી છે અને મારે આપણા આ વૈવિધ્ય ધરાવતા સમાજને સ્વીકારવાના કોઈપણ અવસરને આવકારવો છે. આ નેશનલ આદિજાતિ લોક દિન પ્રસંગે હું બધાને આભૂમિના ઇતિહાસ અને ફર્સ્ટ નેશન્સ, ઇનુઇટ અને મેટિસ સમાજ વિશે વધુ જાણકારી મેળવવા પ્રોત્સાહિત કરું છું.

- હરકિરત સિંઘ ઉપ-પ્રમુખ, વોર્ડ 9 અને 10, પ્રમુખ, કોર્પોરેટ સર્વિસિસ, સીટી ઓફ બ્રમ્પટન

"બ્રમ્પટનનો વૈવિધ્યસભર સમુદાય, તેની ધરોહર અને સંસ્કૃતિ જ આ શહેરને ખાસ બનાવે છે. આપણા વૈવિધ્ય અને આદિજાતિના સમાજોનું યોગદાનને વધાવી લેવા સિટી ઓફ બ્રમ્પટન સાથે જોડાવ અને સ્થાનિક આદિજાતિની માલિકીના વ્યવસાયોને અમારા આ જુન 22ના ઇવેન્ટને સમર્થન આપશો.

- પૉલ મોરિસન (Paul Morrison), ચીફ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર, સિટી ઓફ બ્રમ્પટન

-30-

કેનેડાના સૌથી ઝડપી વિકાસ કરતા શહેરો પૈકી એક તરીકે બ્રમ્પટનમાં 7,00,000 લોકો વસે છે અને તેમાં 75,000 વ્યવસાયો છે. અમે જે કંઈ કરીએ છીએ તેનો હાર્દ છે લોકો. અમને ઊર્જા મળે છે અમારા વિવિધ સમાજોમાંથી, અમે રોકાણ માટે આકર્ષણનું કેન્દ્ર છીએ અને અમે તકનિકી અને પર્યાવરણીય નવિનતા તરફ દોરી જતી યાત્રાનું નેતૃત્વ કરીએ છીએ. અમારી ભાગીદારી એવા નિરોગી શહેરના વિકાસ માટે છે જે સુરક્ષિત, ટકાઉ અને સફળ હોય. અમારી સાથે [Twitter](https://twitter.com/brampton), [Facebook](https://facebook.com/brampton), અને [Instagram](https://instagram.com/brampton) પર જોડાવ. વધુ જાણવા માટે www.brampton.ca

मिडिया संपर्क (MEDIA CONTACT):

सीटी ओड् ब्रॅम्पटन मल्टिकल्चरल मिडिया

multiculturalmedia@brampton.ca